



## Bansal Roofing Products Ltd.

## NSIC-CRISIL Rated Company, An ISO 9001-2015 Company

Registered Office: (Unit II) 274/2, Samlaya-sherpura Road, Village: Pratapnagar, Taluka: Savli. District: Vadodara-391520, Gujarat-India. (L): +91 99250 60542 (M): +91 85111 48598 Email: cs@bansalroofing.com CIN No. L25206GJ2008PLC053761, Website: www.bansalroofing.com

Date: February 09, 2024 BRPL/SEC/2024/07

To,
BSE Ltd.
Corporate Relationship Department,
P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001

Subject: Intimation under Regulation 30 of the SEBI (LODR) 2015 - Newspaper clippings of the Published Financial Results for the Quarter & Nine months ended on December 31, 2023

**Scrip Code:** 538546

Dear sir/ Madam,

In terms of Regulation 47(1) and (3) read with Schedule III of the SEBI Listing Regulations, the Company hereby informs that the Un-Audited Standalone Financial Results, in accordance with Regulation 33, for the Quarter and Nine Months ended on December 31, 2023 of the financial year 2023-24 have been published in Financial Express (Gujarati) and Financial Express (English) Newspapers on 9th February, 2024, the copies whereof are attached herewith for your records.

As required under Regulation 46(2)(q) the said publications have also been placed, for reference of the members, on the Company's website at www.bansalroofing.com as well as on the website of BSE Limited at www.bseindia.com.

This is for your information and record purpose

Yours Faithfully, For, Bansal Roofing Products Limited

KAUSHALKUMAR SATYANARAYAN GUPTA Digitally signed by KAUSHALKUMAR SATYANARAYAN GUPTA Date: 2024.02.09 11:39:09 +05'30'

Kaushalkumar S. Gupta Chairman & Managing Director DIN: 02140767



| O.            | NHUM<br>NHUM   | ગુહમ હાઉસિંગ ફાયનાન્સ ભીમી ટે:<br>કાયનાન્સ લીમીટેડ લશેકે જાણેતી) સ્ટાસ્ટર્ડ<br>છડ્ડો માળ,ગોરો અને સાઈટીપાર્ક, કમનં. ૩૮/૧, કોસ્પરી,  | onela: cor  |  | પશ્ચિમ (V<br>[ગુરાતે નિલ્લાન ૮(૧)]<br>કર્મનામાં ભોતીસા<br>(સ્લાનાસ નિલ્લાકના માટે)  |
|---------------|--|---|---|--|---|
|               | tt olar (erra B v r<br>ca edel e-3 (lee di<br>lac el ec poot ( el di<br>l-11d van do el el v<br>al eo v a (t) domi<br>di oo v a (t) domi<br>l van od 4 tu a al | etter i Steller                     | 10-4 - 4(10-4)()<br>11-4 의 수 100-4)()<br>(), 2002 - 4 France<br>121-3 - 41 학자의 04<br>14 () - 41 학자의 04<br>14 () - 41 학자의<br>04 주() - 41 학자의 | e-relivitiz 수·리 -ri<br>eri-reli e pro -rife<br>e secelulo sil versio<br>colluse-ri elet go u<br>-reli li e esistizi tr-zio<br>-ri e li esistizi tri<br>reli si li escizi ciuta | ानं कोबारी मा क्यों पत्री कि बोक्स वीपोर्ट क<br>कर कोबोर्ट्स करने की नहीं कीमर कोक की क्योंद्री<br>कर कोबोर्ट्स कर बार्ट्स के की क्योंद्री<br>भागता कर्युं की<br>कोबोर्ट्स कोबोरी नदिस्तानं, 2002 न मिस्ट स्टब्स<br>कोबोर्ट्स कोबोरी नदिस्तानं, 2002 न मिस्ट स्टब्स<br>कोबोर्ट्स प्रक्रियों ने निकास क्योंद्री कर कियों |
| 5H<br>4.<br>q | 60014-j<br>400<br>12012 (1-6/10)<br>12012 (1-6/10)<br>62910, 12012<br>(2-6/10)   | વિવહનને વિગક<br>મેં તેન્દ્રવાલાનુદા, પહોંદ પાસેનો વિભાન વેન ન્યુ વર્ષ ને પાર હોય કરા<br>પાર, લો મી. ડીને દરીન ને, દરેક દો, મેં ન્યાર , કેમ કાર કરાદ લોધો,<br>"કારાંગ દરિકે-સો" નદીકે પાસીને લાકોન, કારણ, બીપોમાળ, હોટ<br>ને, લા-કાર, કેમ કારા હતુ કારી મી. હાર્લામે ને, કરક છે, કુદ, મુલન-<br>પાસીના કિંદનો કાર્યા, હોય કિંદનો કાર્યો કાર્યો કરો કરો<br>પાસીના કિંદનો કાર્યો કાર્યો કાર્યો કાર્યો કાર્યો કાર્યો કરો<br>પોતાલા કાર્યો | 92/2028   | 6)-g-14 -1811<br>-6:264-3 -6:44<br>-6:5-5 4 2022   | માંગામાં નેટકેમની<br>ક્ષમ (શ.)માં<br>વ્રાનની III.02222In.6 ૧૮૮૮૧૧<br>કુ. ૧૧૩ ૧૯૦૦ કર્યું (સ્થિક પાજ દાખ<br>વેશાડ ઉપાદ છે.00) ઇંગી અને ઇ ગીર<br>પૈશા પૂછ) અંદ્રીબર્ડીએ ૨૩ ગુજન<br>યુદ્ધના ધાર તેમજ યુદ્ધ હશાસૂહી લઇ .મ<br>ના દર્ષે નાળ ને  |
| 2             | અશેક ડેંગર<br>પારેલ, સફુલ<br>અશેકભાઇ<br>પારેલ, પારેલ<br>કવિતા  | વરના, દક્ષિયા: ફ્રોટ ને લોફોરલ<br>ફ્રોટ ન હિન્મ વાર્ચને લગ્દ પોંચી માત, ત્રીત્ર ફ્રાવ દ્દાર લોગી, હાર્યટ<br>બંધિલ શતને દર એ થો.મી. (બ્રિટ પાય બેલિલા શતને ત્રાય લોગી, નીલ<br>બેલિલ તેમને લગ્દ નોનાનો ન બેલિલા હોલ દિલ્લાને વિદેશનો,<br>વિદ્યાંત્રનાનો, ક્રાયું-અન્યાઓફ નેત્રનાને દત્યાના, ત્રીત્ર હોલ હોલ<br>અત્યાં ત્રામ છો.મી. લોએ-માન્ય-લોશી, તાલું હોન લોગ્દ ન, લિલો ન-લોગ્દ<br>અને ત્રીત્ર છો.મી. લોએ-માન્ય-લોશી, તાલું હોન લોગ્દ ન, લિલો ન-લોગ્દ  |   | of  k 2 2022   | की न नी III. ८२२२४४४ त. १. १८८४४४६ इ. १८ (इस्कि नीस कार<br>प्रस्ताकी करण स्त्रीक को को अध्यक्ष<br>पंत्रा पुत्रा ) कर (१८२४४० इ. १९०४<br>दुक्त नामा १ ते १९२४ व्यक्त सुक्ती १४ )<br>इक्त नामा १ ते १९४४ हुए कार्याक्ष  |

## homefirst

# Home First Finance Company India Limited CIN:1.65990MH2010PLC240703 Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

#### કળજા નોટીસ

સંદર્ભ ( કિલ્કોલેટી ઇન્ટરેસ્ટ (ઇન્ફોલેમિન્ટ) નિકામી, સ્ટલ્સ ના નિકામ ના પેટા – નિકામ (૧) હૈલ લગભ નીટીસ પ્રધાવવાનું કે હોમ કર્સ કાલનાન્ક પંત્રી હોન્દા હોમ્પીટના નીટી પહો રનાવાલાદિક લાકિસ્ટારીઓ અન અને રીકન્ય,સ્વાન બોક કાલનાનિક્કલ એનો, ઇન્ફોલેમિન્ટ એક કિલ્કોલીડી બન્ટરેસ, સ્ટલ્સ (સ્ટલ્સ નિકાસ) નીટી અને ક્લોન્ટ નીટીસ બોક્સિક્ટ (ઇન્ફોલેમિ) નિકાસ, સ્ટલ્સ નિદામ કરાવે વધા કલમ ૧૬) હેલ્લા નીટી બપાવેલ લાંભીઓએ મોગામ નીટીસ બાદી કરી, નીટી આપોલ્ડ નોટીસ્ટારીએ અંદર્શન નીટીસ બપાવેલ ભિષ્ટાની ઇન્સિક્ટ ના લાંધી સ્ટલ્સ આપાવું તું. ઇમલ તાનું મોર્ચ સ્ટલ્સ નિકાસ નિકાસ નિકાસ નિકાસ નિકાસ નીટીસ પાયાની લાંધી સ્ટલ્સ નીટીસ પાયાની લાંધી સ્ટલ્સ ની પેટા દલમ૧૨ (૪) સાંદર્ભ વેલાનો નેના નિકામીની એમવાલાઓ દિવસ મુક્લ વર્ષા મોર્ચ પ્રત્યા કર્યા હોલ્સ કર્યો હોલ્સ નીટીસ પાયાની સ્ટલ્સ કરોના માર્ચ સ્ટલ્સ કરોના સ્ટલ્સ કરોનો સ્ટલ્સ માર્ચ કરોનો સ્ટલ્સ માર્ચ કરોનો, સ્ટલ્સ નીટીસ વ્યાપેલ ક્રિક્સ ટ્રિક્સનોની સમયો લાગો લોકોલ

| કમ<br>નં. | દેવાદાર /<br>સહ-દેવાદાર / જામી વદારર્નું નામ         | ગૌરો મિલકત ની<br>વિગ ત  | માંગણ<br>નોટોસનો<br>તારોખ | શાંગણા નોટોસનો<br>તારોળ મુજબ બાહો<br>રહમ (જ્ઞ.) | કબજા નો<br>તારોખ |
|-----------|--|---|---------------------------|---|------------------|
| 1.        | સંતોષકુષાર સિંહા, સિલ્ટેશિટ સિંહા,<br>વસામપદ્મી દેવી | ફલેટ-૩૦૮, સોથ સંવર્ડમેન્ટ, રકાસોડનગર, શિરો, વાપો, ગુજરાત-૩૯૧૧૯૧   | 03-06-2023                | 15,37,029                                       | 04-02-2024       |
| 2         | વ્યાસ શેતનભાઇ સંશોહોત,<br>વ્યાસ ફિટાયેન શેતનભાઇ      | ફલેટ-૩૦૩, લ્લોક-બી, ઓમ શાંતિનગર-૧ પાસે અને ગોલ્ડ પ્લસ, લાંભાવટવા<br>કેનાલ સેડ, વટવા, અમદાવાદ, ગુજાસત-કર્દરાઈં૦  |                           | 7,84,135  | 04-02-2024       |
| 3.        | શ્લ-ગુજાઇ લર્ટમાંભાઇ સહેડ ,<br>રાપલયેન દાનગુજાઇરાહેડ | લ્લોક નં.૧૧, પ્લોટ નં.૮૨ છાને ૮૬, મારાતી પાર્ક, રક્ષિણ-પૂર્વ, કમ નં.૧૪૫ પૈકો<br>૫, પ્લોટ નં.૮૨ છાને ૮૬, મારાતી પાર્ક, પોપલી ગામ, પટેલ વિકાર કોટેલ પાછલ,<br>ઇક્સ્પાર પેટોલ પંપ સાથે, મોરાબી-પોતપર સેડ, મોરાબી, ગપરાત-કાદકાઇપ |                           | 11,74,981                                       | 04-02-2024       |

છોસ્સાર પેટ્રોલ પંપ સાથે, મોરખી-પેતપુર સેડ, મોરખી, ગુપરાલ-૩૧,૩૧૪૧ દેવાદાસે ૧૯૦મની શુદ્રવામી ૭૦ વામાં નિષ્ફળ ગરાા હોવાલી દેવાદાસું જારી નદાર અને જાહેર જમતાને આશી જાળ ૭૦ વામાં આવે છે કે નીસે સહી ૭૦ નારે જણાવેલ નિર્ણયોના નિર્ણ દયાદા ભારતમાં લુકાયા કરાયામાં મહત્વ ગયા. હાયાદા યાધારા જાનાનાર અને જોક અનાન આશા આ કરવામાં આવે છે. તેના કહા કરનાર આશાહ મહત્વ માના નાતા \* રહ્યાં લેવાની જાયાંલ એકટની કડમ ૧૩(૪) હેઠળ તેનેલીએ ગ્રાપ સત્તાનો ઉપયોગ કરીને અહીં નીશે જાયાંલ બિલાનો કરનારે ઉપર આયાંલ તારીઓએ હા લીડીએ દેવારાણે જાનારણે અને જોક અનાન કે આશી ઉપર આયાંલે ભિક્તો અલાય તેના કોળ ત્યાં સોને નકરવા કાર્યાક કરવામાં લાળે છે અને આયોલે બિલાનો (સિક્સો એસોરા સાનો કોળવા સોરો હોમ ફર્સ્ટ કંપની લિંગ્ડ લીધીટેડની ઉપરની બિહાનો ઉસેડોડ એસોરા સામે આવેલ કરમને લાહિન દેવો એ પુરેણી સુકળી સુકી તેના પરન ઘટત વ્હાજ સાહેશુ કવવાપાય છે.

આદારાનું દરામ દારખામાં પ છે. અદિાકૃત અદિાકારો, હોમ ફર્સ્ટફારા વાન્સ કંપની ઇન્ડિસા લોમોટેડ સ્થળ : ગુજરાત , તારોખ : ૦૯–૦૨–૨૦૨૪



## બંસલ રૂફિંગ પ્રોકક્ટ્સ લીમીટે**ક**

**રજીરટર્ક ઓફીસ:** ૨૭૪/પૈકી ૨, સામલ્યા શેરપુરા રોડ, ગામ-પ્રતાપનગર, તાલુકો-સાવલી, િભ્રો-વડોદરા-૩૯૧૫૨૦ ફોન નં. : ૮૫૧૧૧ ૪૮૫૯૮ CIN : L25206GJ2008PLC053761 Smattering Comma /ina Start BABER: CS@bansalroofing.com | นิดเลเมระ: www.bansalroofing.com

|    | (ફા.લામમાં વેસ્ટીઠ કમાલી સિવાસ)  |            |                  |            |            |            |            |  |  |  |  |
|----|--|------------|------------------|------------|------------|------------|------------|--|--|--|--|
| 44 | વિત્રતો  | বিখা       | जिङ्ग आस्त्रानां | tid        | नय शहि     | ાદ-ના અંતે | વર્ષાતે    |  |  |  |  |
| ÷. |  | 31.12.2023 | 20.09.2023       | 31.12.2022 | 31.12.2023 | 31.12.2002 | 31.00.2023 |  |  |  |  |
|    |  | યનઅલિક     | અનસઉદક           | અ-અહિંદક   | અ-અહિંદક   | અનસાઉરક    | અલ્લિક     |  |  |  |  |
| 1  | કામકાલમાંથી કુદ્ર શાયક   | 2572.10    | 2998.48          | 2247.70    | 8169.69    | 6877.95    | 9342.56    |  |  |  |  |
| 2  | ગાળાનો શેષ્મ્યો નહો/ (તોડ)(વેદા, અલવાદરૂપ દીજો છત્ને અદાવા અસાધાદાત દીજો પહેલા)                          | 106.38     | 107.82           | 131.39     | 368.50     | 371.59     | 558.14     |  |  |  |  |
| 3  | વેદા પૂર્વે ગાળાનો શેખનો ન ફો/ (તોડો)(સ્થયવાદણ શીજો સને સ્ક્લાદાદાદ શીજોપછી)                             | 105.38     | 107.82           | 131.39     | 368.50     | 371.59     | 558.14     |  |  |  |  |
| 4  | વેશ પછી ગાળાનો શેલ્બો નહો / (તોડો) (અલવાટરૂપ શ્રી જો અને આલવા અસદારાદ કરીજો પછી )                        | 77.44      | 83.09            | 87.90      | 275.88     | 278.56     | 417.06     |  |  |  |  |
| 5  | ગાળાની કુલ સભાવેશક સાલક (ગાળાના કુલ સમાવેશક નહૃદ્દોતોટો વેદા પછી અને અન્ય<br>સભાવેશક સાલક વેદા પછી સહીત) | 77.44      | 83.09            | 87.90      | 275.88     | 278.56     | 417.06     |  |  |  |  |
| 6  | ઇક્લિટી શેર મુડી ( શેર દીઠ મુલ ઉમત ફા. ૧૭/– )  | 1318.32    | 1318.32          | 1318.32    | 1318.32    | 1318.32    | 1318.32    |  |  |  |  |
| 7  | દતના પ્રક્રિવટી ( પૂર્વપુરશાંકિત અનાવતો સિવાલ)<br>પાડલા વર્ષના ઓસ્ટિટ સરવીલામાં ટર્વાવ્લા મુજબ           |            |                  |            |            |            | 1086.95    |  |  |  |  |
| 0  | shafe a serial (suffering and all) area and arrained (suffering all)                                     | 0.00       | 0.00             | 0.67       | 2.00       | 9.11       | 9.10       |  |  |  |  |

सार्थाः कृत्यस सार्थाः कृत्यस

DIN : 02140767

સહી;– આદિફૃત અદિકારી ગુલ્મ લાવેલિંગ ફારાનાન્સ લોગેરેડ (અગવેપુનનાવા લવેલિંગ ફારાનાન્સ લેગેરેડ ત્વીક બાલીતે)

| -  | ennerta .  | યુહ્રમ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ<br>(અર્જા પુનવાલ અદિભ ફાયનાન્ય લોપેટ નાદે જ્યોનો)<br>અને પ્રાપ્ત કર્યું પર તેમે જ માર્ચ ના કર્યા હતું તેમાં પૂર્વ છે.   | ***                       | હ્વમ ૧૩(૨) હેઠળ<br>માંગણા નોટીસ  |
|----|--|---|---------------------------|--|
|    | ો નીશે લાશ નેલ દેવાલ શે/સદ – દેવાલ શે/જારીના                               | દ શેરો ગુંહમ હાઉસિંગ ફારાનાન્સ લીમીટંડ (અગાઉપુનાનાલા હાઉસિંગ ફારાનાન્સ લીમી   | <b>१५ तही ई का जी ते</b>  |  |
| ήď | ो बादिशिंग इ। छन्। न्स पण्डी इ कान दीशी है 5 ईप                            | ગેલ્લર, રેકરર શી લક્ષ્મીનો ગુલલ લક્ષૈરિકેંગ ફ્રાટલાન્સાલીથી દેડ કરેલ છે (સાગાઉ ૧૦૧૧ લાં<br>દીના નામ સંસ્થામીત) અહીં પછી સિક્સોર્ડ લેવાદાર તરીહે લક્ષા પેલ છે પસોલી તમારી સ્થાન  | મિલાહતો ગોશે ડા           | દીને હોમ લોન/લોન્સ અગેનસ્ટ્યોપર્ટી સનલ   |
|    |  | ને પશ્ચિમને તમારી લોન/નો નોન પર ફોમિંગ એકેટો તરીઠે વર્ગો ફૂત કરાઈ હતો. સિક્સો સેટ   |                           |  |
|    |  | હુટ ની ઠાલ માવર ટે હેલા માંગ ઘર્યને ટીકો. આ હી <b>ક</b> ઠમની ન સુલાત માટે છેલાં જાણકોતા કાક   |                           |  |
|    |  | હેર્સવેન્ટ) નિશ્લમો, ૨૦૦૨ ના નિશ્લ ક્ર(૧) સાથે ત્રેશાતી એક્ટની ઠલાવ ૧૩(૨) મુજબ છા   |                           |  |
| 4  | हिराहम्, कर-विहास ५,<br>पानी नाम-तुंनाम, कोन-वे दक्ष                       | Demois Rosed-1 Dina   | भागामा नाडी कर्नी<br>असीम | माडी क्षत्रहार्थ   |
| q  |  | મુલાય-મોદબી, તાલુલો–ગાય-દવાયદા દેવન્યુ સર્વે નં. રપ/ર પૈકી ૧ પૈકી ૧ સને સર્વે   | 06/01/2029                | રૂપ. ૧૦,૫૮ ,૪૮૫.૦૪/– (રૂપિશા દરમ ભાગ   |
|    | શંદ્રિકાળેન છકેન્દ્રભાઇ  | ને, સ્પાર પૈકી વર્ષે કીંગ લાને સર્વે નં. સ્પાર પૈકી રાશને સર્વે નં. સ્પાર પૈકી રાશના છો.<br>પ્રદોગ નં. ૨૦૦૦ થી ૨૧૦ ૧૦૦ લાગીન સંભાવત પ્રગાન વર્ષોથી કિલ્લા કેલ્પિટનથી છા   |                           | અહાવન હજાર શાસ્ત્રો પંરશાંત્રી અને   |
|    | लोननो २६४: इा. १२,७५,०००/-   | પ્લોટ ને ૨૦૦ લી ૨૧૦ કુલ ભ્લોન સેવાકલ ૫૦૦-૮૧ લો.કી. બિલ્ટ ઇકિડેન્લીલલ<br>બિલ્ડીંગ, "નેસ્ટ હિલ", વીજો માળ કહેટ ને ૩૦૨, બિલ્ટ સપ એસ્ટિંગ ૧૭૧-૪૨<br>લો.કી. (ટેસ્ટનનંદ્ર કલિયલ) ખુતેની વિવકતના તમાર ભાગ અને હિસ્સા. સતુ:સીમા                   |                           | શુંમોત્તેરપૈસા પુષ્ટ) તેમજપરત યુકવાર્ટ   |
|    | ตโคค์.หหมายมหานายการ   | શો.મી.(ટલ્સનાહ કરિયાશ) ખાતેની મિલકતના તમાર ભાગ છતને દિલ્લા. શતુ:સીમાં<br>: પર્વ : શેનાશે. શેડ.પર્વાર : શેનાશે. પ્લોટ નં. ૨૦૨, ૨૦૪ શને ૨૦૫.ક્તિષ્ટ : કોર્યન  |                           | સુધી વાર્ષિક ૯.૦૨% ના દરે શક્ત વ્યા  |
|    |  | પૈકીજ, વિક્ટ અને શીડીઓ, ફવેટ ને. 20૧ અને મુખ્ય દરવાઓ, દરિયા : જ્યીન,<br>એન છે. પ્લોટ ને ૨૧૧   |                           |  |
| 2  | बारोता नायुष्ट पद्मचंत्रस्त्र, बारोता                                      | દેવન્યુ સર્વે નં. ટપાઇ છે/૦પૈકી, પ્લોટ નં. 20 ઉત્તર ભાવુનો ભાગ, અવદાત સોસાસડી,<br>ભોરાહ સાટક પાસે, લેવુલલ સોસાસડી પાસે, મુકામ-ભોરાહ, તાલુકો–દિસા, જ્યો-   | 06/01/2029                | হা. ১,৭০,৫২৭.৫১/– (কৃমিল্যা গাম জাদ  |
|    | બદાવંતસિંહ ધૂંદ્રોજી, વાલેલા કરસનવા  | બનાસકાંડા, લેબકળ કરંદ કરા શો. હટ, લોકાશ કાટક ડિસા, પીનકોડ-કરપપથ   |                           | બાવન હજાર નવાનો એકવીસ અને વ્યાં  |
|    | બલવંતસિંહલોનનો સ્ક્રમ: ફ્રા.૫,૦૦,૦૦૦/-                                     | બનાસકોઇ, સેબફલ કેઇ.કર્ટ્સ, સે. કુટ, ભેટીમાં ફાટક ડિસા, પીનકોડ–કરપયરપ<br>ખાતેની વિવકતના તથામ ભાગ અને હિસ્સા, સતુ:સૌમાં : પૂર્વ : શેડ, પર્યોગ : પ્રાંટ તે.<br>રજનું શર, ઉત્તર : પ્રોટ ને. રઠ નું શર, દરિપક : પ્રોટ ને. ૩૦પેડીની ૧મીનનું શર્ |                           | વૈજ્ઞા પુષ્ટ) તેમજપદત ચૂકવાશી સુધી   |
| 2  |  |   |                           | વર્ષિક ૧૫.૫% ના શકે ૧૩ત વ્હાજ  |
| 2  | રબારીસ જ્લોન્સનાબેન ખોડાભાઇ, રબારીસ<br>ખોડાભાઇ લખપાયભાઇ, રબારીસ લટપાયભાઇ   | દેવન્યુ સર્વે નં. ગ્રૂ/૧, પ્લોટ નં. ૧૦૫, શિવધાલ દેવિટેન્સી બી શકાપુર, શવકોટ,  | 06/04/2058                | ્રા.૧૦,૯૫,૪૯૧,૦૫/– (કૃષિશા શત્ત્ર લા<br>પંચાણે હજાર શાસ્ત્રો કર્ણ અને પંચોત્રેટ પૈ |
|    |  | સેવફલા ૧૩૩૬ શો. કુટ, શાકપુર, પીનકોડ-૩૬૦૦૦૧ ખાતેની મિલકતના તમાર ભાગ<br>અને હિસ્સા. શતુ:સીમા : પૂર્વ : ખુકી જમીન, પરિખ : શેડ, ઉત્તર : ખુકો પ્લોટ, પ્લોટ નં.   |                           | પશાપું હજાદ શાસા કર્યું છા મેં પેશાસદ પ<br>પુષ્ટ ) તેમજપદત શુક્રવાની શુક્રી વાર્ષિ |
|    | ટ્યુલાઇ લોનનો સ્કલ: ફા.૧૭,૨૧,૧૯૯)ન લોન<br>નં.৮৮.01052-,19.100172           | ૧૦૪ ની વર્ષીન, દક્ષિણ : યુવો પ્લોટ પ્લોટ નં. ૧૦૪ ની વર્ષીન  |                           | पुष्तः) तमगपरतपुरुपक्षाः चुराः पापः<br>१३१६ मा रहे १५८त प्रापः                     |
| ¥  |  |   | - 45 5                    |  |
| •  | विरुप्त राज्यातात परनराट्य, स्ट गरा<br>विरुप्त राज्यातात रोजनी स्ट्रण: हा. | સબપ્લોટ ને. સ્ટ્રોલે (ઉત્તર વાલુનો ભાગ ), રેવન્યુસર્વે ને. સ્વરૂપિયી કે ૧, ગાળી હોલ્સરેસિટેન્કી.<br>ગામ-વર્ષો મેટી, તાલુકો- સંજાર, રેલ કુળ ૫૦.૦૦ સે, મી., વાગે ક્રી હોલ્સ પાસે, પીનકો ટુ-૩૦૦ ૧૧૦  | 06/01/2029                | રૂ. ૪,૮૯,૬૬૦.૦૮(– (રૂપિશા શાક લાખ<br>નેવ્યાંથી હજાદ છસ્સો શાકભાર અને ઇંડોને        |
|    |  | ખાલેની મિલાઇતના તેમાં મામાં ભાગાંધા ને લિક્સા. શતુઃસ્ત્રીમાં : પૂર્વ : સભપત્રીટ ને. ૨૧/છો, પરિદામ : ૭.૫૦  |                           | યેશ પુષ્ટ) તેમજપદત શુક્રવાણી સુધી  |
| _  |  | મીટ રનો પહોલો રેડ , ઉત્તર : સબપ્લોટ નં. રડ/લી , શરૂ છાં : સબપ્લોટ નં. રડ/લી   |                           | વર્ષિક ૧૫.૫% ના શકે ૧૩ત વ્હાજ  |
| ч  |  | શોધ નં. ૮, અર્પિત સેપાર્ટલેન્ટ શોપિંગ સેન્ટર, તૃત્વી કોમ્પદેણ પક્ષે, અંકદેશર-<br>બુરદાનપુર હાદયે પડણે, સંકદેશર સેવફળ ૮૭ શો. ફૂટ, તૂત્રી કોમ્પદેણ પક્ષે,   | 06/04/2029                | જ્ઞ. ર,2૧,૦૩૧,૩૯/– (જમિશા છ લાખ એક વ<br>કુજાર એકતાલસી અને ઓગણપરશાસ પ               |
|    | લીનની સદય: રૂા. દ્, ૩૦,૦૦૦/ –  | પીનકોડ–20200૧ ખાતેની વિલક્તના તમાંથ ભાગ અને દિવસી. સતુઃસોથા : પર્વ :<br>જાહેર રોડ, પંચિમ : પાર્કિંગ જગ્સા, ઉત્તર :થોપ નં. ૮, શેરપા: પ્લોટ નં. ૧૦૧–છે.–રપ  |                           | પુત્ત ) તેવજ પત્તત શુરુવાળી શુધી વાર્ષિક   |
| _  | GIM =1.IILG222/IL1C/ICCCC/I  |   |                           | ११, ५% ना देहे सदल वेसाय   |
| £  | શાંસ્ત્રાજવર્મા, સંદિત વર્ષા   | ક્રવેટ નં. ૧૭૧, સેવફળ ૩૦.૫૧ શો.મી. (૪૨૫ શો. ક્રૂટ) તેમજજમીનનો ન વહેંશાશેલ<br>હિલ્લો ફેબફળ ૧૪.૩ શો.મી., આઉન્ડ જમીન, પહેલી માલ, "ગોફળ–થશુશ કોમ્પલેસ   | 06/04/2029                |  |
|    | लोजनी स्थ्यः हा. १०,5५,०००/-   | યેકી ગોફળ" તરીકે જાણીતી બિલ્ડીંગ, મુકામ-બ્લોક નં. દૃદ્ કોનાએ. જ્યીન,  |                           | दश्तर नयसो सीर्सावी पुरा) तेभक्षपरः  |
|    | രിചച്. HL00 നഡഡഡെയയ  | ર્વેકી ગોડુલ" તથીકે જાણીતી બિલ્ટીંગ, મુકામ-બ્લોક નં, દૂદ છોનાએ, જ્વીન,<br>મહિલાગર લોલાલડી વેકી ઉત્તર બાજુ, પશ્ચિમ બાજુનો પ્લોટ નં, કદ અને પર, કુલ<br>સેબફલા યયગદ્ધ લો.મી. વેકી કદ્દા દર લો.મી., જ્લીન, મુકામ-કાટ્રોટલ, વેટા જિલો          |                           | <b>યુ</b> કવાની સુધી વાર્મિક્ત૧.૦૫%ના ટો   |
|    |  | સુવારા વચ્છે.પુર શામાં વકા કર્યા પુર શામાં, વગાવ, વુકાવ-કાકારક, વડા છતા<br>અને તાલુકો-પલશાયા, વિશ્વો-સુકત, શવદા-ચુવજ્ઞત ખાતેની બિન-પેતીઘાદક   |                           | tica dila  |
|    |  | રેસિડેન્સીશવ મિવકતના તમાર ભાગ અને હિસ્સા, રાતઃસોથા : ઉત્તર :  |                           |  |
| _  |  | સ્વામીનાશાશા વેઢેસ, દરિપાર :શેડ, પૂર્વ : શેડ, પશ્ચિમ : શેડ ૈ  |                           |  |
| 0  | લંદિરા પરોશભાઇ, લંદિરા પુનવલેન   | મોલે-ભાગલોડી, સુરત પાતેની વળીન, કલાબીવાડ સાથ પંચાયત હાઉસ નં. 20, નવો<br>હાઉસ નં. 31, ડેલાકલ ૮૧,૦૦ શો.મી., સિડી સર્વે નં. ૧૦૦૦, શિડ નં. ૧૫ શાવતા નં.   | 06/04/5058                | 4  |
|    | <b>પટોશકુ</b> શાર  | પઠ. "તામી દર્શન કહેટ" તથી કે જાહીતી. પૈકી ગીજો માળ, કહેટ નં, 202, ઝોળ 201   |                           | नेपुं दश्यद पायको पीटनादीक पुरा) नेभ   |
|    | લોનનો સ્કલ: ફા.૧૧,૪૫,૦૦લ/-   | 22.00 લો.મી., મુદાય-૧૯૬ફેશન જિલો લાને પેટા જિલો-લીલાંલી, સુરત, રાજ્ય-   |                           | પશ્ચત શુકવાળી શુક્ષી વાર્ષિક ૧૨.૫% ના  |
|    | होन नं. स. एकक्षरपण पण प्रकार अ  | ગુજરાત પાતેની બિન-પેતીગ્રાશક જમીન, પ્લોડનાં તથમ ભાગ અને હિસ્સા.   |                           | tica tilly   |
|    |  | શ્રંતુ:શ્રીમા : પૂર્વ : હાઉસ, પશ્ચિમ : હાઉસ, ઉત્તર : રોટ, ટરિગ્રા : રિવર સ્લોમ  |                           |  |
| ć  |  | જેવન્યુ કર્વે ને ૩૮ ,વ્લો 5 ને, ૮૦, પ્લોટ ને . ૩૮, સ્વર્ગૃધિકેન્ડ હોય ,શોય હરીઓમ્પાર્ક, વાંક કામ્   | 06/01/2029                | જ્ઞ.૦,2૫,૩૧૮.૧૨/ – (કૃષ્યિલા ભાત લાગ<br>પાગીસ ૯૧૧૦ શાસ્ત્રો આઝલ્ડ લાને સોડ         |
|    | લોનનો રકમ્દ ફા.૧૦૦૦૦૦/-  | વર્ષીની મુલાય-મોલે-કારેવી, તાલુ કો-પવસાંકા, વિલો-સુરત, રેલાફળ 206 શે. ફુટ, તુવસી<br>પેયર મીલપાસે પ્રીનકોડ-2602૧૫ પાતેની વિલકતનાતભાગ ભાગણ ને કિસ્સા, શતુઓના પુર્વ  |                           | પણ્યાસ હજાર શારસા અગ્રસ્ટ અન સાડ<br>પૈસા પુરા) તેમજ પરત શુંકવાની સુધી              |
|    | कोन नं.सहरपश्चयसः ४ रपपञ्चन  | : લોલાશ્ટીનો લેડ, પંચાય : પ્લોટ નં. ૪૩, ઉત્તર : પ્લોટ નં. ૨૯, દરિપાર : પ્લોટ નં. ૨૯   |                           | વાર્ષિક ૧૫%ના દરે ઘટત વ્યાજ  |
| ç  | अनिताओन विषयाङ्कषाञ्च पर्देख, पर्देख विशास                                 | <del>દે</del> ણન્યુ સર્વે નં.૨૦૦, બ્લોક્ નં. ૧૩૬, પ્લોટ નં. ૧૨૫, ૨૭૭ વિલ્, લાંઇક્ષ્ય ભ્યોનુ <u>યુ</u> કાયન્   | 06/01/2029                | इ. ८, २०,०२९.०ए/- (इधिया साट दाप   |
|    | વિજરૂભાઇ, પરેલ વિજય લસ્ત્રકા<br>લોનની સ્ક્રમ: સ. 60000લે –                 | થો લે- કરાડાં તા તાલુંલો- ઓલપાડ, લિલો-સુરત, લેવે ફળ 200 સો. કુંદ, ઓમસાંઇ રેસિંટેન્સી<br>પાસે. પીનલોડ- 2004:00 ખાતેની મિલલતના તથાય ભાગ અને હિસ્સા, શાત:સૌથા : પર્વ :   |                           | ਦੇ। 2ਵੀਂਦ ਫ਼ਾਨਦ ਦੇ 2ਵੀਂਦ ਦਮ ਦੇ ਦਾਵ ਪੈਦ<br>ਪਦ ) ਜੇਵਨਾਪਦਜ ਦੁਤਾਹਰੀ ਦੁਖੀ ਵਸਵਿੱ         |
|    | Gle et HMAY 20 H7 37 00 402  | પાસ, પામ કાડ-૩૯૩૫૩૦ ખાતમાં ભાગ કહના હવાય ભાગ શામ (હસ્સા. સાંદુ:સાંચા : પૂર્વ :<br>સોસાસ્ટ્રીનો સેટ, પશ્ચિમ : પ્લોટ ને. ૧૩૮ . ઉત્તર : પ્લોટ ને. ૧૩૮ . દક્ષિક : પ્લોટ ને. ૧૩૮   |                           | पुष्तः) तरुपरत्तवृद्धवद्याः सुधा वापः<br>१५३६ ना स्ट राज्य व्यापः                  |
| -  |  | ું છે ને આશો આ નોડીસના રું દિવસની અંદર ઉપર પ્રદાનેલ પ્રફેપુરી મોગલાની રહ્ય તેમ પ્રઉપ  |                           |  |

## કળજા નોટીસ

মতো , শৰ্ম সামানু আননা পৰি প্ৰতিষ্ঠিত (২০ বাল লোকৰ বালিক) কৰিছিল।
কৰিছিল পৰি প্ৰতিষ্ঠিত (মানু বিষ্ঠিত লৈ দুৰ্বি ইনি কৰিছিল।
কৰিছিল কৰিছিল কৰিছিল কৰিছিল কৰিছিল কৰিছিল কৰিছিল কৰিছিল।
কৰিছিল ক

| स्था तीन नंबार के विकास में स्थापन के कारण क |   |          |  |  |                                  |
|--|---|----------|--|--|----------------------------------|
| प्रस्ति होता हुन्य निवास स्थापना स्थापन स्थापन स्थापन स्थापन स्थापना स्थापना स्थापना स्थापना स्थापना |   | લોન નંબર |  |  | अकार काने                        |
|  | , |          | ર્સાતનોલી પ્રેપરાસ્ટર<br>ઉર્વશોએન ક્લલેશકુશાર<br>જરીવાલા, ૨. થ્રી ક્લલેશ | ફા. ૧,5૧,૦૮,૧ <i>૦૮</i> /-<br>(કૃપિશા શેલ્ડ કરોડ<br>છળીશ લાખ શાહ હજાદ<br>છશ્શો ઇડ્ટાંતેર પુરા) | ૦૧ તેપ પોલોલ<br>છાનો<br>સાંદેતિક |

વિસ્તારી કિંગ્લાનનો વિચારના વૃદ્ધિનાં માં 200, પોલાનો માતા, તોપાવાર 201, પદ લોપી, શુપર ભિલ્દા કપા એકિશા હાને મહત્ર કહ્યાં લી.શ. કાર્યો. એકિશા તેમળ ૧૧, 20 મો.સે., ક્ષી કિંમના હર્લિકની કાર્દીમાં ના પહેલાલેલ ક્લિકને કંપાયતાની કંપાયતુ કાર્ય ને હાય, બાંદે ન ને પદ તે તેમાં ક્લા 200 તેમાં લી.શ. કાર્યો માત્ર 200, વર્ષ હોતી, માત્રે કર્યો કાર્યો, કાર્યો કર્યો કાર્યો કર્યો કાર્યો કર્યા કરવા કર્યા કરા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર

| र्थ पदार्थ टेश्वरंग १००० दस्य<br>श्रेष्मात एश्वरंग १००० दस्य<br>श्रेष्मात एश्वरंग १०००<br>श्रेष्मात १९११ १००० पदार्थ ,<br>श्रेष्मात १९११ १००० ५०० |                |                    | 00/02/2028<br>૧૨:૫૫ પોછોલ<br>જાનો સાંહેલિક<br>કબજો |
|---|----------------|--------------------|--|
| Grand & Grand and   | Garagian de la | and a medianic man |  |

(સ્કારતા કિંમાના લિંગાના વાંત્રાના તે, તે સખનેના પત્રનું વાંદાડામાં ત્રેપકારા ૧૯૦૦ ભાગી. વાર્ષી લાગોઓની વાર્ષીય તો એમોની વાર્લા કિંદનો કોશાની ત્રીની કોશાની સ્કારિતી ત્રીની ત્રીની શર્તી ને પાર્ટ, ફાર્કાના વાંત્રાને, ૧૯૦, ત્રીકિન પાર્કીના કરીમ ને ત્ર ઉભાર, જિલોફાસ ખાતેની ભાગીનાના તમામ માત્રની સ્કારતા ક્રાર્કીના કાર્યા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કરાયા કર્યા કર્યા કરાયા કરાયા કરાયા કરાયા કર્યા કરાયા કરાયા કરાયા કરાયા કરાયા

| 3 | 3 424 CS 20 005 5CJ | ૧. ગ્રમગોપાઇસિંઘ,<br>૨. નિકિક્દ્રમારી | ૦૫/૦૨/૨૦૩૪<br>૦૨:૧૫ પોલોલ<br>લાનો<br>લોહિક<br>કળજો |  |
|---|---------------------|---------------------------------------|--|--|
|   |                     |                                       |  |  |

વિભાગી તે મિતારા ને વિભાગ કરીએ નો તમા પાંત્રીમાં માત્ર પાંત્રી માત્ર કર્યું કર્યું માત્ર કર્યુ માત્ર કર્યું માત્ર કર્યુ માત્ર કર્યુ માત્ર કર્યુ માત્ર કર્યુ માત્ર કર્યા માત્ર કર્યુ માત્ર

| ¥ | si 42si esi2 0002 é0é ,<br>si 42si esi50 000 540 |  |  | ૦૨:50 પોલોલ<br>જાનો<br>લોનિક<br>કળવો |
|---|--|--|--|--------------------------------------|
|---|--|--|--|--------------------------------------|

प्रभाग प्रशासन पुरुष प्रशासन के प्रभाव के प्रशासन पुरुष प्रभाव के प्रभाव के प्रशासन के प्रभाव के प्रशासन के प्रभाव के प्रभाव

િલ્ફારા તાર દો લાગી ખાત જો ને કિંદ જ વાર્યો કો દાવારો છત્રે ખેતા જે અનાત ને નીટ કા લાગાનો વાર્યો કે બેના એક તા વાર્યો કે બેના માત્ર તા હો કે બેના માત્ર તા કર્યો કે બેના કે બાદ કરતાં હો કે બેના કે બાદ કરતાં હો કે બેના કે બાદ કરતાં હો કો કે તે તે

### રસાત : અભટાવાટ રહેલું - અદિહૃત અદિહારો તાર્જેબ : ૦૯.૦૨.૨૦૨૪ં જના સ્મોલ ફાઝનાન્સ બેંઠ લોવોટેડ વતી 🥼 જના સ્મોલ ફાયનાન્સ બેંક

(<u>(૧૧૦,૧૦૦)</u> ૧૫૧ માટે છે. ૧૫૧ માટે લેક ૧૫૧ માટે લેક ૧૫૧ માટે ૧૫૧ માટે ૧૫૫ માટે ૧૫૫૫ માટે ૧૫૫ હુટ શાનંદ નગર રેડ , રસમલ, શામદાવાદ, ગુપરાત-૩૮૦૦૧૫

## MAGPUR MUNICIPAL CORPORATION

offinissional NMC fives e-enders for the following Work. failure No. 1/2023-24/EE(Project-3) Construction of Shrimant Raje Raghojirao nosale Town Hall in Mahal area Nagpur. The details of e-tender can be ownload by the Bidder e-tendering Portal (www.mahatenders.gov.in). ost of Work- Rs 92,81,47,348/-. EMD- Rs 5476069/-. Cost of Blank Tender- Rs 5900 (with GST), Bid Sale & submission start date 08.02.2024 2) Pre-Bid Meeting: 20 Feb 2024 at 12.30 Hrs. in the office of Horrble Chief Engineer, Civil Lines, NMC Naggur, 3) Tender Submission End Date 28.02.2024 (17:00 Hrs) 4) Tender Opening Date 01.03.2024 (17:00 Hrs)

Executiva Engineer (Project-3) N.M.C., Nagpur Advt No. 985 PR Date 08.02.2024

#### બિજસિક્ચોરિટીઝ લીમીટેડ

विषय (दिन्याविष्टा) विषया (८) (१): (८२): ४०८-११९४ (८.०२४७७२ १८६, चुरून भोव, प्रधाभुत जंगली-च, साधन्य (सही शेऽ, स्रोता, अभववाद, दर्कांग्रे, गुरुवत, नाशन-४८०५० ११.१२:२०२३ जा शेष्ट्र पुरायतां विधासिक अने वृत्य पासिक

|    | ગાળાના અન−ઓડિર્ટેડ નાણો <del>કિ</del> ય પરિભામોનું નિવેદન |            |             |               |  |  |  |  |  |  |
|----|---|------------|-------------|---------------|--|--|--|--|--|--|
|    | (ગૂ. લાખનાં કંપીસંટા ક્રિનારા                             |            |             |               |  |  |  |  |  |  |
| ×  | [4×al   | विमासिक-स  | ર્ભની છતી   | पाछ्या स्पर्ध |  |  |  |  |  |  |
| ŧ. |   | ald        | તાઉપના      | হাধান         |  |  |  |  |  |  |
|    |   |            | 36(45)      | િભાઉદાના એટો  |  |  |  |  |  |  |
|    |   | 29.922022  | 29.92.20 22 | 29.92.30-22   |  |  |  |  |  |  |
|    | gaexino   | 22.52      | 80.24       | 22.06         |  |  |  |  |  |  |
| 2  | ગાળાનો શોખ્યો નફા (તેશ, છાપના દર્ય                        |            |             |               |  |  |  |  |  |  |
|    | અને/અલના અસાહાદવા કોજો મહેલા )                            | 96.34      | 36 a4       | -4020         |  |  |  |  |  |  |
| 2  | તેશ પૂર્વે ગાળા નો લોખ્યો નફો (અપનાદસ્ય                   |            |             |               |  |  |  |  |  |  |
|    | દીજો અને /અદના અસાહાદ હા દીજો પછી )                       | 96.34      | 26 a4       | -9030         |  |  |  |  |  |  |
|    | રેસ પછી ગાળાનો કો ખ્લે ન ફો                               |            |             |               |  |  |  |  |  |  |
|    | (અપનાદરૂપ શીજો અને/અદના અશાકાશક શીજો પછી)                 | 96.34      | 28.00       | -45,92        |  |  |  |  |  |  |
| ŧ  | ગાળાની દુવસંયુક્ત સાનદ                                    |            |             |               |  |  |  |  |  |  |
|    | (તેવા પછી)  | 96.34      | 28.00       | -45,92        |  |  |  |  |  |  |
|    | લક્રિયાની લોજ મુળી  | 22.59      | 22.59       | 22.59         |  |  |  |  |  |  |
|    | શક્તિ તો લેજ ખુલી નો મુલ દિવત                             | 9.0        | 90          | 90            |  |  |  |  |  |  |
|    | શેષ્ટ ક્રીડ કમાહી (મુલ/ક્રાટાટેલી)                        | 0.44       | 0.01        | -0.36         |  |  |  |  |  |  |
| ĕ  | છે: શેલ્લી (એલ્લ્સો ટ્રેસ્ટાર) નિવયનો , આ વધન નિવયન કર    | day edicel | 588)-94(5)  | φαρθα δημβιο  |  |  |  |  |  |  |

નીઇ: શેલી (ઇલંકા) ટીકા ૧) નિવશનો, અધ્યાન નિવશન 23 હેલ્લા ૧લી લઇ કરાઇન્સ્સાં ફાઇલ ટરોક ડિશા છે. સાલાંદિલ પશ્ચિમાંની નિવસ નાશ શાહિતીનો શાશ ઉપર મુખલ છે. વિપાર્શક હાર્યનાને માહિત નાલાંદિલ રહિલાઓની શ્રેપૂર્વ મહિતી ૧લીલ છેક્કાઇ અની નેચલાંકદ ઇન્ડિલેડ પ્રયુષ્ટ banda com ઉપરાધિ કર્યા હોઈ છે. હોલ્સાંક્રિકાઇલી કર્યા હોલી ૧ન્સ હોલ

#### SURYA INDUSTRIAL DEVELOPMENTS LIMITED

CIN.L65921WB1980PLC033204 Regd. Office:14/1B Ezra Street Kolkata 700001 [2200@gmail.com, http://suryaindustrialdevelopme Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter and nine month ended December 31, 2023

|     |  |               |               | (7 in Lakhs              |
|-----|--|---------------|---------------|--------------------------|
| SL. | PARTICULARS  | Quarter ceded | Quarter ended | Year ended               |
| No. |  | (Unsudited)   | (Unaudited)   | 31-Mar-2023<br>(Audited) |
| 1   | Total income from operations (net)                     | -             | -             | 7.93                     |
| 2   | Net Profit' (Loss) for the quarter                     |               |               |                          |
|     | (before Tax, Exceptional and/or Extraordinary Items)   | 9.41          | (0.02)        | 6.24                     |
| 3   | Net Profiti[Loss] for the quarter before tax           |               |               |                          |
|     | (after Exceptional and/or Extraordinary Items)         | 9.41          | (0.02)        | 6.24                     |
| 4   | Net Profit(Loss) for the period after tax              |               |               |                          |
|     | (after Exceptional and/or Extraordinary Items)         | 9.41          | (0.02)        | 4.62                     |
| 5   | Total Comprehensive Income for the period              |               |               |                          |
|     | [Comprising Profit / (Loss) for the period (after tax) |               |               |                          |
|     | and Other Comprehensive Income (after tax)]            | 9.41          | (0.02)        | 4.62                     |
| 6   | Equity Share Capital                                   | 20.00         | 20.00         | 20.00                    |
| 7   | Earnings Per Share (of Rs. 10/- each)                  |               |               |                          |
|     | Besic :  | 4.71          | (0.01)        | 2.31                     |
|     | Diluted :  | 4.71          | (0.01)        | 2.31                     |

Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange and the listed entit



#### ભારત ક્રો–ઓપરેટીવ બેંક (મુંબઇ) લીમીટેડ.

(<u>(૧૯૨૦ – ૨૨૦ (૧૬ ગુલ એક)</u> સેન્ટ્રલ ઓફીસ : "માછતાગી શૈ", પ્લોટ નો. ૧૩/૯એ, સોનાવાલા સેક, ગોરેગાંવ (પુર્વ), મુંબઇ-૪૦૦૦૬૩, ફોના : ફ૧૮૯ ૦૦૮૮ / ફ૧૮૯ ૦૧૩૪ / ફ૧૮૯ ૦૦૮૫

સ્થાવર મિલકત/તોનું હરાજી વેચાણ

નોટીસ

| 0 M<br>≠i. | દેવાદાર/શેગેંજર<br>અને શાળાનું નામ  | માં ગશા નોટીસ<br>મુખ્ય બાહી રહન   | ગિલાકતાનો વિગત અને<br>બેંકનો જાણમાં<br>હોરા તેવા બોજા  | ૧. રીઝર્ધ ફિલ્મેત<br>૨. છઇમડો<br>૩. બીડ યુદ્ધિ ની સ્કલ<br>(સીલી ઉંચી બીડદો<br>ઉંદરી છત્ત્રે વધારે) | ૧. નિર્ફિઝાની<br>તારીખ છાને સથસ<br>૨.ટેન્ડરો/છોફરો<br>જમા કરવાની છેલી<br>તારીખ છાને સમસ          | રેન્ડફો<br>ખુલવાની<br>તાર્કોખ સથસ<br>શાને સ્થળ |
|------------|---|---|--|--|--|--|
|            | કૃતિ નિદ્દેશ શોમસંદરભાઈ<br>પરશાર<br>ગીઇન્ટ/ અંક - દેવાદાર:<br>કૃતિયતી હિંદહ<br>નિદ્દેશભાઈ પરભાર<br>( છામદાવાદ શાખા)<br>( પહેલી હરાજુ નીદીસ) | લોન ઇક્રાઉન્ટ નં. ૧૦૧૨ ૩૩.5૦૦૦૦૪૧ ૪<br>ફા. ૨૨,૮૦, લ૧૧,૧૧/ – ૦૪.૧૧. ૨૦૨૧ મુખ્ય<br>તેમજ પાર્ષિક ૯,૯૦ ટકાના દરે ઇક્રત<br>વ્હાજન ૧૫.૧૧.૨૦૨૧ છો તેના પર પાર્ષિક ૨<br>ટકાના દરે પેનલ ભાજ. | મધુવન ગ્લોરી, ગ્રીનાશ (નરોડા) કો–<br>ઓપરેડીવ હાઉસિંગ સોસાશડી લીમીટેડ   | 1. \$1. 25,00,000 /-<br>2. \$1. 2,50,000 /-<br>5. \$1.50,000 /-                                    | 1. 09'.05.2029'<br>20102'11. 00 til<br>2019'04 .00 शुहरी<br>2. 17. 05.2029'<br>2019'04 .00 शुहरी | १८.05.2028<br>ना डोफ<br>क्रमडे<br>११.50        |
|            | કૃતિ અલો કરો હજી ભાઇ<br>શહોડ<br>( લામદાવાદ શાખા)<br>( પહેલી હસાજી નોટોસ)  | ત્રેમજ વાર્ષિક ૧૩.૦૦ ટકાના દરેશક્ત સાજ<br>+ ૧૮.૧૦.૨૦૨૧શો તેના પર વાર્ષિક ર  | ગુજરાત હાઉદિયાં ભોડની દર્શીભમાં, દિવ<br>દાયવદાદ શહાદમાન, વાર્કાનાં માર<br>ભોગામ દોડ, ગીંતા, ખાતેના ફાયનડા<br>પત્ની ડે મેં. રા. ડાંકી વાર્કાનાં દર્શીમાં ને<br>પત્ની કોંગ હોડ જમીન પણ લોકાલે કોમેં<br>ગીતા, તાલુકો દાદાવોદિયા, જિલો<br>અમદાયાદ અને દરમ્પદ્રેના માર પદ્રિક્ષી<br>અને દિલ્હીન્દ્રીનાદ અમદાયાદન્દ ((લોકા),<br>ગુજરાત દાયદા–26000 ખાતેની<br>મિલાટતા. (બીલાંક કળતે બેંક પાસે છે) | ₹. ড়. ₹, 00,000/-<br>5. ড়. 50,000/-  | ૧. ૦૧. ૦૩.૨૦૨૪<br>સાવારે ૧૧. ૦૦ થી<br>આંજે ૦૫.૦૦ સુદી<br>૨. ૧૧. ૦૩.૨૦૨૪<br>આંજે ૦૫.૦૦ સુદી       |  |

જાનામાં તર હોવા છે. 3. નિર્વાદારી સ્વાર્થ એવિ-ને સરાશ એવિનો ખેતીનાર શારી ઉપત રેળવ્યા ખડે ૧૯૩૧ બીડાંથો ફરો હાયો કરે છે. 6. તરફાળ પીર્વે મીડની શરની પડ પડ (૧૯૩૧ જોઓ કહીનો પી-ખુલ્યાન દિવસે ભળાતો સમાચીન શાહુ દિવસે લખ કરવાની શર્મો અને આઈની બડાં પડા ૧૯૩૧ અંગો ખુલ્યાની તાર્જી ખેત પરિક્રાન્ત્રી પાર્ટ અને આદિ કેટો, કહ્યા લોઈને જ લાભાદા ખૂબની સ્થાની આદ્માં અને પડા સ્વાર્થ અને હોલ્યોનીની શ્રમ દીધાળ ધન્ન નીડીન પાર્ટ આપ્તે એ

સ્થળ : ગુજરાત અદાકૃત અદાકારો

PROTECTING INVESTING FINANCING ADVISING

ADITYA BIRLA HOUSING FINANCE LID Registered Office: Indian Rayon Compound, Veraval, Gujarat 362266. Branch Office: Aditya Birla Housing Finance Limited, 3rd Floor, Office No. 203 to 211, Milestone Fiesta, near TGB Circle, L.P. Savani Road, Adajan, Surat- 395009

## [Rule 9(1) of Security Interest (Enforcement) Rules 2002] ALE BY PRIVATE TREATY OF IMMOVABLE ASSET CHARGED TO ADITYA BIRLA HOUSING

FINANCE LIMITED UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002. ("SARFAESI ACT") The undersigned being the Authorized Officer of Aditya Birla Housing Finance Limited (hereinafter referred to as "ABHFL") has taken the physical possession of the immovable property being "All That Piece And Parcel Of Immovable Property Bearing Plot No. 75 As Per Site Admeasuring 51.66 Sq. Yard I.E., 43.19 Sq. Mts., I.E., 465 Sq. Ft., (As Per Kjp Block No. 349/75 Admeasuring 43.93 Sq. Mts.), Along With 24.63 Sq. Mts. Undivided Share In The Land Of Road & C.O.P, In "Aradhna Sky Park Part-1', Rudrax Residency, Situated At Revenue Survey No. 338/1, Block No. 349 Admeasuring He. 1-34 Are 38 Sq. Mts. I.E., 13438 Sq. Mts, Of Moje Village Kareli, Ta: Palsana, Dist: Surat, Gujarat 394315, And Bounded As: North: Adj. Plot No. 76, South: Adj. Plot No. 74, **East: Adj. Soc. Int. Road, West: Adj. Soc. Boundary"** (Secured Assets) under Section 13(4) of the Securitization & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 200 (hereinafter referred to as "SARFAESI Act. 2002") which stood secured in favor of ABHFL towards financial facility, its outstanding dues of INR 9,43,174.26/- (Rupees Nine Lakh Forty Three Thousand One Hundred Seventy Four and Twenty Six Paise Only) as on 12/01/2023 and further interest and other expenses incurred thereon till the date of realization to the Borrowers/Co-Borrowers Hemant Sukhlalbhai Mahajan, Rahul Sukalal Mali, Mona Hemant Mahajan (hereinafter referred to as "Borrowers/Co-Borrowers").

That on failure of the public auctions/e-auctions of Secured asset the undersigned is enforcing its security interest against the said Secured Asset by way of sale through private treaty under the provisions of SARFAESI Act, 2002 and rules framed thereunder. The Authorized Officer has received an expression of interest from a prospective purchaser towards purchase of the abovementioned Secured Asset. Now, the Authorized Officer hereby giving the Notice to sell the aforesaid Secured Asset by Private Treaty in terms of Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules 2002. The Sale will be effected on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS" and "WHATEVER THEREIS BASIS" on or after 28-02-2024 INR 9,43,174.26/- (Rupees Nine Lakh Forty Three Thousand One Hundred Seventy Four and Twenty Six Paise Only) as on 12/01/2023 due to ABHFL from the Borrowers/Co-Borrowers. The reserve price of the Secured Asset is fixed at INR 4,50,000/- (Rupees Four Lacs Fifty Thousand only).

The Borrowers/Co-Borrowers are hereby informed that all the requisitions under the provisions of SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002 have been complied with and ABHFL is now under the process of enforcing its security interest by effecting sale of the Secured Asset as mentioned herein by way of private treaty as prescribed under the provisions of Rule 8 (5) of Security Interest (Enforcement) Rules, 2002.

Further the Borrowers/Co-Borrowers attention is invited to provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the said Secured Asset.

PLACE: Surat DATE: 09-02-2024 (Aditya Birla Housing Finance Limited

# BANSAL ROOFING PRODUCTS LIMITED

Reg. off. 274/Paiki 2, Samlaya Sherpura Road, Village Pratapnagar, Taluka Savli, Dist. Vadodara - 391520 Ph.No.: 85111 48598 CIN NO.: L25206GJ2008PLC053761

Email: cs@bansalroofing.com website: www.bansalroofing.com

|     | ract of Standalone Unaudited Financial Results for the   | Quartor    |               |            | акиз ехсе  |            |            |
|-----|--|------------|---------------|------------|------------|------------|------------|
| Sr. | PARTICULARS  | C          | luarter endec |            | Nine Moi   | nths Ended | Year ended |
| No. | PANTICULANS  | 31.12.2023 | 30.09.2023    | 31.12.2022 | 31.12.2023 | 31.12.2022 | 31.03.2023 |
|     |  | Unaudited  | Unaudited     | Unaudited  | Unaudited  | Unaudited  | Audited    |
| 1   | Total Income from operations   | 2572.10    | 2698.48       | 2247.70    | 8169.69    | 6877.95    | 9342.56    |
| 2   | Net Profit/ (Loss) for the period (before tax, Exceptional and/ or Extraordinary items)  | 106.38     | 107.82        | 131.39     | 368.50     | 371.59     | 558.14     |
| 3   | Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/ or extraordinary items)   | 106.38     | 107.82        | 131.39     | 368.50     | 371.59     | 558.14     |
| 4   | Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)   | 77.44      | 83.09         | 87.90      | 275.88     | 278.56     | 417.06     |
| 5   | Total Comprehensive Income for the Period [Comprising Profit/(Loss) for the period after tax and Other Comprehensive Income after tax] | 77.44      | 83.09         | 87.90      | 275.88     | 278.56     | 417.00     |
| 6   | Equity Share Capital (Face Value Rs 10/- Per Share)  | 1318.32    | 1318.32       | 1318.32    | 1318.32    | 1318.32    | 1318.3     |
| 7   | Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance<br>Sheet of the previous year.                            | -          | -             | -          | -          | -          | 1086.95    |
| 8   | EarningsPer Share (Face Value of Rs. 10/- each) Basic as well as Diluted (Not Annualized)  | 0.59       | 0.63          | 0.67       | 2.09       | 2.11       | 3.10       |

1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the 3rd Quarter and nine months ended on 31st December. 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the of Unaudited Financial Results for the 3rd Quarter and nine months ended on 31st December, 2023, is available on the website of Stock Exchange at www.bseindia.com as well as on the company's website at www.bansalroofing.com.

2. These Unaudited Financial Results have been reviewed by the Audit Committee in its meeting held on 8th February, 2024 and were approved by the Board of Directors in their meeting held on 8th February, 2024.

Place : Vadodara Date: 8th February, 2024

By Order of the Board For Bansal Roofing Products Ltd. Sd/- Kaushalkumar S. Gupta Chairman & Managing Director DIN: 02140767

# griwise AGRIWISE FINSERV LIMITED (Formely Known as Star Agri Finance Limited)

ogistered office: S01-604, 6th Floor, Sahar Pleza Complex, Bosanza Intomational, Near J B Nagar Motro Station, ndheri Kurta Read, Andheri (East), Mumbai- 400059, CIN: UBS899MH1995PLC267097, Web: www.agriwise.com POSSESSION NOTICE [(Appendix IV) Rule 8(1)]

Whereas the Authorized officer of Agriwise Finsery Limited formerly known as StarAgri Finance Limited, a Non-Banking Financial Company under the provision of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) (hereinafter referred to as "Act") having its Registered Office at 601,6th Floor, Sahar Plaza Complex, Bonanza International, Andheri Kurla Road, Near J B Nagar Metro Station, Chakala, Andheri (East), Mumbai- 400059 (hereinafter referred to as "Mortgagee") and in exercise of the powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice dated 28-OCT-2023 calling upon: The Borrower, Co-Borrowers and security providers i.e. 1) CHOTHA RAMUBHAI BHARVAD S/O RAMUBHAI BHARVAD (LAN NO. LSSECMEH0000846), 2) JASIBEN CHOTHABHAI BARVAD W/O CHOTHABHAI RAMUBHAI BHARVAD ALL R/O, 189-K, BHARVADVAS, NEAR MOMAI MATA MANDIR, AT MANPURA (UN), TAL, KANKREJ, BANASKANTHA, GIJJARAT 385560. ALSO AT:- SHREEHARSIDDHI TRACTOR, HOUSE OPP. INDIAN GAS OFFICE COLLEGE ROAD RADHANPUR KANDALA HIGHWAY, RADHANPUR, DIST. PATAN GUJARAT 385340. To repay the amount mentioned in the notice being Rs. 22,18,005/ (Rupees Twenty Two Lakh Eighteen Thousand Five Only) due as on 28-10-2023. along with the applicable interest and other charges within 60 days from the date of receipt of

"The borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) And of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 06TH day of FEBRUARY, 2024.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of "Agriwise Finsery Limited formerly known as StarAprl Finance Limited" for an amount of being Rs. 22,18,005/- (Rupees Twenty Two Lakh Eighteen Thousand Five Only) due as on 28-10-2023, along with the applicable interest and other charges.

'The attention of borrower is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

## SCHEDULE I

(DETAILS OF SECURITY/ MORTGAGED PROPERTY NO.1)

All that Piece and Parcels of Property Bearing At Manpura (UN) Gram Panchayat Property No. 362/1, Assessment Serial No. 417, "Bharvad Vas" (Gamthan) Admeasuring 621 Sq. Pt. Tal. Kankrej, Dist. Banaskantha in Registration Sub-district Kankrej and Bounded As Under : North : Property Of Jakshibhai Motibhai Bharvad, South : Open Land, East : Temple Of Mornai Mata, West: Property Of Mavabhai Karmanbhai Bharvad.

**Authorized Officer** Date: 05/02/2024 Agriwise Finsery Limited Place: MANPURA (KANKREJ) Formerly Known as StarAgri Finance limited

## PANACHE DIGILIFE LIMITED

CIN: L72200MH2007PLC169415 Regd Office: Building No. A3, Unit No. 102 To 108, 201 To 208, Babosa Industrial Park Saravali Village, Bhiwandi, Thane - 421302 Corporate Office: B-507, Raheia Plaza Premises CSL, L.B.S. Marg, Ghatkopar West

Mumbai - 400066, MH, India Tel.: +91-22-2500 7002, Website: www.panachedigilife.com, Email: info@panachedigilife.com Extract of Unaudited Financial results for Quarter Nine months ended 31st Dece

|            | Particulars  | Standalone |           |   | Consolidated |                 |   |  |
|------------|--|------------|-----------|---|--------------|-----------------|---|--|
| SI.<br>No. |  |            |           | Corresponding 2<br>months ended in<br>the previous year |              | Year to<br>Date | Corresponding 3<br>months ended in<br>the previous year |  |
|            |  |            |           | (Un-Audited)  |              |                 |   |  |
|            | Korner zu zu ze  | 31-Dec-23  | 31-Dec-23 | 31-Dec-22   | 31-Dec-23    | 31-Dec-23       | 31-Dec-22   |  |
| 1          | Total Income from Operations   | 1,521,235  | 4,175.840 | 477.507   | 1,521.235    | 4,175.840       | 477.507   |  |
| 2          | Net Profit / (Loss) for the period<br>(before Tax, Exceptional and/or<br>Extraordinary items#)   | 26.162     | 47.165    | 5.427   | (32.503)     | (38.227)        | (3.962)   |  |
| 3          | Net Profit / (Loss) for the period<br>before tax (after Exceptional items<br>and/or Extraordinary items#)  | 26,162     | 47,165    | 5.427   | (32.503)     | (38.227)        | (3.962)   |  |
| 4          | Net Profit / (Loss) for the period<br>after tax (after Exceptional and/<br>or Extraordinary items#)  | 22,709     | 40.746    | 9,643   | 56,001       | 76.423          | (8.178)   |  |
| 5          | Total Comprehensive Income for<br>the period [Comprising Profit /<br>(Loss) for the period (after tax)<br>and Other Comprehensive<br>Income (after tax)] | 22.709     | 40.746    | 9.643   | 56.001       | 76.423          | (8.178)   |  |
| 6          | Equity Share Capital   | 1,200,000  | 1,200,000 | 1,200,000   | 1,200,000    | 1,200.000       |   |  |
| 7          | Reserves (excluding Revaluation<br>Reserve) as shown in the<br>Audited Balance Sheet of the<br>previous year   | 2,437.540  | 2,437.540 | 2,437,540   | 1,912.650    |                 |   |  |
| 8          | Earnings Per Share<br>(of Rs. 10/- each)<br>(for continuing and<br>discontinued operations) -  | 16         |           |   |              |                 |   |  |
|            | 1) Basic:  | 0.189      | 200740000 | 0.080   | 0.467        | 0,638           | (0.068)   |  |
|            | 2) Diluted:  | 0.189      | 0.340     | 0.080   | 0.467        | 0.638           | (0.068)   |  |

 a) The above is an extract of the standalone and consolidated financial results for the quarter & nine months ended 31st December, 2023 filed with NSE under Regulation 33 of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015. The full format of the said results is available on websites of NSE and the listed entity i.e. at www.nseindia.com and www.panachedigiilfe.com respectively.

 b) Previous period figures have been regrouped/rearranged wherever considered necessary. By Order of the Board

|                           | For Panache Digilife Limited |
|---------------------------|------------------------------|
|                           | Sd/                          |
| Date : 8th February, 2024 | Amit Rambhia                 |
| Place : Mumbai            | Managing Director            |
|                           | 200                          |

| केनरा बैंक Canara Bank 📣 | Delhi Chakla Road Branch<br>E-001, Sumel-6 Business Park,<br>Dudheshwar Brts Road, Dusheshw<br>Shahibaug, Ahmedabad-380004 |  |  |  |
|--------------------------|--|--|--|--|
|                          | ICE [SECTION 13(4)]<br>BLE PROPERTY)   |  |  |  |
| 160 TI 1 1 1 1 1 1 1 1 1 | U : 100 (U 0 D 1   |  |  |  |

Whereas, The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 01/12/2023 calling upon the borrower, M/s. J P (alias M/s J P Gym) Partner / Guarantor Mr.Pritesh B Kahar and Partner / Guarantor Mr. Jav D Shukla and Partner / Guarantor Mr. Jasmin B Khatri & Guarantor Mrs. Anjaliben G Chaurasiya alias Anjali Priteshkumar Kahar and Guarantor Mrs. Madhuben D Shukla and Guarantor Mrs Chandrikaben B Khatri) to repay the amount mentioned in the notice, being Rs. 69,03,902.02 (Rupees Sixty Nine Lakh Three Thousand Nine Hundred Two and Two Paise Only) as on 30/11/2023 in Synd Udyami Service-term Loan (Term Loan) together with further interest from 01/12/2023, and applicable charges, within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rule on this 6th day of February of the year 2024.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs.69,03,902.02/- (Rupees Sixty Nine Lakh Three Thousand Nine Hundred Two and Two Paise Only) as on 30/11/2023 in Synd Udyami Service-Term Loan (Term Loan) together with further interest from 01/12/2023 and applicable charges.

The borrower's attention is invited to provisions of sub-section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of Immovable property Property-1 All the piece and parcel of constructed immovable property Flat No.50/593 2nd floor admeasuring 26.80 sq.mtrs. in the Scheme which is known as "Shrinath Apartment" Which is on the part of Land bearing Survey No.420 of Town Planning Scheme No.29 of Final Plot No.756/1 Situated at Mouje-Vadai,

Boundaries: East: Flat No.50/594, West: Open Marginal Space Road, North: Flat no.50/584, South: Flat no.50/596 Property-2 All the piece and parcel of constructed immovable property Flat No.504 5th floor in Block No.D (D/504) admeasuring 115.38 sq.mtrs. together with 37.47 sq.mtrs. undivided share in the land of the scheme which is known as "AVALON-60" Which is on the part of Land bearing Survey No.60/1, 60/2, 60/3 of Town Planning Scheme No.45 (Motera-Amiyapur-Sughad) of Final Plot No.47/1 Situated at Mouje-Motera, Taluka-Sabarmati, District - Ahmedabad & Sub District

Taluka-Ghatlodia, District -Ahmedabad & Sub District Ahmedabad-2 (Vadaj).

Flat No.D/503, South: Common Plot Property-3 All the piece and parcel of constructed immovable property Plot No. 129/2 Ground Floor admeasuring 90 sq.mtrs.in the land of the Gokulesh Co-Operative Housing Society Ltd. In Sector no.3(A) Situated at Mouje -Gandhinagar Taluka - Gandhinagar, District-Gandhinagar & Sub District Gandhinagar, Bounded as under: North: Plot No.129/1, East: 8 Mtrs. Road,

Ahmedabad-6 (Naroda). East: Wall of the Scheme, West: Flat No.D/501, North:

West: PlotNo.134/1, South: PlotNo.131/1. Date: 06/02/2024

Authorized Officer. Canara Bank Date: 08.02.2024, Place: Gujarat

### यूनियन वैंक 🕦 Union Bank Regional office Mehsana, Nr. Wide angle, **E - AUCTION SALE NOTICE** Mehsana highway, Nagalpur, Mehsana-384002 , Ph 02762-230246,240250. The first warmen Email - cmrd.romehsana@unionbankofindia.com

E Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to Rule 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s, that the below described immovable property mortgaged / charged to Secured Creditor, the Possession of which has been taken by the Authorised Officer of Union Bank of India. Secured Creditor, will be sold on "AS IS WHERE IS", " AS IS WHAT IS", and "WHATEVER THERE IS" on 28.02.2024 12:00 PM TO 17:00 PM, for recovery of below mentioned respective amounts due to the Union Bank of India, Secured Creditor from below mentioned respective Borrower and Guarantors. The respective reserve price and earnest money deposit will be as under:

| Sr.<br>No |   | Description of Property  | Amount of<br>Debt due   | Encumbrances<br>known to secured<br>creditor & Type<br>of Possession | Reserve<br>Price (Rs.)   | i) E.M.D.<br>ii) Bid increment<br>amount by                                | Name of the<br>authorised officer,<br>Cont No./ Email Id      |
|-----------|---|--|---|--|--|--|---|
| 1.        | Balvantsinh Babusinh Parmar (Applicant) Keshvial Jethabhai Vankar (Guarantor) Both Add- At Berna, ta Himmatnagar, Dist Sabarkantha - 383001 Hasmukhlal Shamaldas Patel (Guarantor) 76, Adarsh Bungalows, Near Sharnam Society, Medical Road, Motipura, Himmatnagar, Dist Sabarkantha - 383001 Union Bank of India (Boriya khurad)   | All piece and parcel of immovable property i.e. Non Agri Land Garthri Land of Berna Gram Panchayat Property No. 778 at Himmatnagar District Sabarkantha, admeasuring 840 Sq. Feet. <b>Boundaries of property</b> -East – Road West – House of Dahyabhai Keshabhai North – House of Gopalbhai Dhayabhai South – Temple  | Rs 8,12,035.76 As per demand notice dated 15.04.2021 & subsequent interest as per agreement               | NIL<br>physical<br>possession  |  | (i) 2,40,000.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 2.        | 1.Shri Pradeep Babulal Darji, Add- 6-508 sarvoday society, darji fali, taluka-talod, dist-sabarkantha     2.Smt Kantaben babulal darji, (Legal Heir of deceased co-borrower late Darji Babu bhai moti bhai) Add- Add- 6-508 sarvoday society, darji fali, taluka-talod, dist-sabarkantha     3.Shri Chirag kumar Hasmukh lal Darji, Add-Gadhoda, Post gadhoda, Taluka- Himmatnagar, Dist- Sabarkantha     Union Bank of India (Himmatnagar-ECB) | All the piece or Parcels of Flat no 307, situated at third floor in A block of Kedar city admeasuring about 50.18 Sq Mtr(Super built up area) having undivided share 16.83 Sq mtrs constructed on Residential NA land Plot no 1, 2 & 3 paiki of Block No 281 paiki of Gadhoda under Gadhoda gram panchayat Taluk Himmatnagar, Dist sabarkantha.  East: Flats of E block of Kedar city, West – Flat no A 306, North-Naliyu, South- Flat no A 308  | Rs 5,36,397.16 As per demand notice dated 13.02.2019 & subsequent interest as per agreement               | NIL<br>physical<br>possession  | 6,75,000.00  | (i) 67,500.00<br>(ii) Rs. 10,000.00  | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 3.        | Mohammad Faruk Fakir Mohammad Memon (Applicant) House no 8, Tamnna bungalow, Near RTO office, Himmatnagar, Gujarat 383001 Mrs Jahedabn Mohammad Faruk, House no 8, Tamnna bungalow, Near RTO office, Himmatnagar, Gujarat 383001 Union Bank of India (Himmatnagar-ECB)  | All the pieces or Parcels of immovable Property in NA land, plot No 386 paiki, admeasuring about 877.20 sq mtrs of S.N. 125/1 paiki, Village Savgadh under Savgadh Gram Panchayat, Ta Himmatnagar, Dist-Sabarkantha belongs to Mr Mohammad faruk Fakir Mohammad Memon East 13.00 Mtr wide road, West – Internal Road, North – Use land of S. No 124, South-7.64 Mtrs vwde road   | Rs 26,48,462,,65<br>As per demand notice<br>dated 09,11,2020<br>& subsequent interest<br>as per agreement | NIL<br>Physical<br>possession  | 78,90,000  | (i) 7,90,000<br>(ii) Rs. 10,000.00   | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 4.        | MR. JITENDRASINH BHIKHUSINH ZALA At vaktapur Dist Sabarkantha 383001 MR CHIRAG ARVIND BHAI SHAH(Guarantor) At Vaktapur Dist Sabarkantha, Himmatnagar 383001 Union Bank of India (Himmatnagar Main)  | All That Piece And Parcel Of Immovable Property I.e. Non Agri Land Block/S No 525 Paiki Shop No 189 Of Salal Gram Panchayat, Situated At Village Salal, Ta Prantij, Dist S.k. with In The Local Limits Of Salal Gram Panchayat, ta Prantij, Admeasuring 24-70 Sq Mtr      All That Piece And Parcel Of Immovable Property I.e. Non Agri Land Block/S No 525 Paiki Shop No 191 Of Salal Gram Panchayat, Situated At Village Salal, Ta Prantij, Dist S.k. with In The Local Limits Of Salal Gram Panchayat, ta | Rs 48,75,526.19 As per demand notice dated 03.12.2019 & subsequent interest as per agreement              | NIL<br>symbolic<br>possession  | 9,00,000.00<br>8,10,000.00   | (i) 90,000.00<br>(ii) Rs. 10,000.00<br>(i) 81,000.00<br>(ii) Rs. 10,000.00 | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 5.        | Bhupendrakumar Revabhai Patel (Applicant) Add- Bileshvar mahadev<br>Mandir, Bhanpur Badoli, Idar, Sabarkantha 383140<br>Revabhai Joitabhai Patel (Co applicant) Add- Bileshvar mahadev<br>Mandir, Bhanpur Badoli, Idar, Sabarkantha 383140<br>Union Bank of India (Himmatnagar Main)  | Prantij, Admeasuring 22-11 Sq Mtr  All Piece and Parcel of immovable property i.e. Non Agri land of S. No. 633 paiki Plot No. 6, admeasuring 150.00 sq. meters situated at Village Bhanpur Taluka Idar District Sabarkantha  Boundaries of property- East- Open Margin Land, West- Plot No 5, North- Public Road, South- S. No. 632  | Rs 5,75,254.95 As per demand notice dated 09.04.2021 & subsequent interest as per agreement               | NIL<br>symbolic<br>possession  | The second secon | (i) 1,48,500.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 6.        | Parmar Shankar Muljibhai (Applicant) Parmar Dharmendra Shankarlal(Co Borrower) Both Add: Plot no 12. Survey no 128/2 paiki, Gokulnagar, jashoda park society Barvav Road, Idat, Dist Sabarkantha Union Bank of India (IDAR)   | All the pieces or Parcels of House Property situated at plot No 12,RS no 128/2, paiki Gokulnagar, Jashoda Park Society, Barvav Road,Idar, Dist - Sabarkantha. East- 6.00 mtr road thenafter plot no 11, West –6.00 mtr road thenafter plot no 17, North-Plot no 13, South-Marginal land thenafter survey no 123  | Rs 10,42,385.85<br>As per demand notice<br>dated 08,07,2019<br>& subsequent interest<br>as per agreement  | NIL<br>physical<br>possession  | U.S.C. 180 (190 (190 (190 U) 190 (190 U) 190 (190 U)   | (i) 2,41,200.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Sanjeev<br>Kumar Jha<br>(Chief Manager)<br>Mb 78000003591 |
| 7.        | Varahi Construction Co, At & post -Jetalvasna, Visnagar, mehsana Amrutbhai Nanjibhai Patel (Proprietor), H N 2/28 Gram Panchayat Anukrasm No 439, Jetalvasna, visnagar, Mehsana Patel Hasumatiben Sanjaykumar (Guarantor) 5-9 Jetalvasna, Visnagar, Mehsana Union Bank of India (Mehsana-2)   | All piece and parcel of property of Gram Panchayat House No 2/28, Gram Panchayat Anukram No. 439 situated at Village Jetalvasana Taluka Visnagar District Mehsana, Admeasuring 825.00 Sq. Feet. <b>Boundaries of property</b> -East — House wall of Parsottambhai Mancharam, West — House wall of Jayantibhai Bababhai, North — Way of Mohlla, South — Ravalvas  | Rs 1,83,739.00<br>As per demand notice<br>dated 19.06.2021<br>& subsequent interest<br>as per agreement   | NIL<br>symbolic<br>possession  | 13,08,000  | (i) 1,31,000<br>(ii) Rs. 10,000.00   | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 8.        | M/s Ramdev trading Co. Prop. Rajnikant Haribhai Patel (Applicant) Shop no 6, Gopal Complex, Junganj, Patan 384265 Patel Haribhai Kalidas (Guarrantor) Patelwas at village Adiya, Taluka Harij, Dist Patan Union Bank of India (PATAN -2)  | All the pieces or Parcels of property no 287,admeasuring 18*69=1242 Sq<br>feet situated at Patel Vas Village Adiya, ta Harij, Dist Patan<br>East- Property of Patel Pitambar nagardas<br>West-Road, North - Property of Darji Pitambar manilal Shankarbhai<br>South- property of Patel Babulal Madhubhai   | Rs 14,13,460.88<br>As per demand notice<br>dated 01.04.2021<br>& subsequent interest<br>as per agreement  | NIL<br>symbolic<br>possession  |  | (i) 1,20,330.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 9.        | Famous Dairy, Mr. Patel Bharatkumar Kantilal 6 Zavery complex, Sidhpur 384151 (Proprietor) Mr. Patel Dineshkumar Kantilal Patelparu Tavdiya, Sidhpur - 384151 (Guarantor) Union Bank of India (Sidhpur-2)   | All piece and parcel of Residential house situated at Revenue survey No. 8/1 of Tavadiya sim, Plot No 8, Gram Panchayat Property No. 5/8, Mahakali Paru at & post Tavadiya, Taluka Sidhpur District Patan Gujarat 384151, Admeasuring 63.84 Sq. Meter  Boundaries of property- East – Internal Road, West – Margin Road, North – Plot No 9, South – Plot No 7  | Rs 5,17,302.00 As per demand notice dated 12.07.2018 & subsequent interest as per agreement               | NIL<br>symbolic<br>possession  | 11,52,000.00   | (i) 1,15,200.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 10.       | Pathan Rajukhan Nanhekhan, (Applicant) Pathan Mahelakabanu Rajukhan (Co Applicant) Both: 7-8 Gulistan park Sopciety, Sidhpur, Dist. Patan, Gujarat 384175 Union Bank of India (Sidhpur-2)   | All the pieces or Parcels of shop No. 87( as per document)/ shop no 144(as per site), admeasuring 16.18 Sq. Meter situated at Revenue Survey No.122 p2 at near Samarth Complex, Near Highway Road, Sidhpur District Patan  | Rs 5,16,813.52<br>As per demand notice<br>dated 08.07.2019<br>& subsequent interest<br>as per agreement   | NIL<br>symbolic<br>possession  | 10,18,800.00   | (i) 1,01,880.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 11.       | a) Mrs.Falguniben Rajesh Shah(Borrower/Mortgagor) Residing At 30, Jivandhara Society, Telephone Exchange Road, PatanPincode-384265 (b) Mr.Rajesh Vadilal Shah ( Co Borrower) Residing at 30, Jivandhara Society, Telephone Exchange Road, Patan - PINCODE-384265 Union Bank of India (UNJHA)  | All the pieces or Parcels of Property consisting bearing Plot No. 31 situated at NA Land, Survey No. 354 Paiki admeasuring 79.70 Sq. Meter of Village Dharpur Taluka & District Patan bounded by: East Godown No 32, West – Godown No 30, North Godown No 12, South 12 Meter wide internal road  | Rs 5,49,655.50/-<br>As per demand notice<br>dated 27,02,2018<br>& subsequent interest<br>as per agreement | NIL<br>symbolic<br>possession  | 6,24,000   | (i) 62,400<br>(ii) Rs. 10,000.00   | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 12.       | (a) MR.Nayi Govindbhai Shankarlal (Borrower / Mortgagor )     Residing At B/H Post Office, Vill-Ambaliyasan, Tal-& Dist-Mehsana     (b) MR.Nayi Satishkumar Shankarlal (Co-Borrower) Residing At B/H     Post Office, Vill-Ambaliyasan, Tal-& Dist-Mehsana     Union Bank of India (UNJHA)  | All the pieces or Parcels of Property consisting bearing Plot No. 39 situated at NA Land, Survey No. 354 Paiki admeasuring 75.00 Sq. Meter of Village Dharpur Taluka & District Patan bounded by East Godown No 38, West – Godown No 40, North 12 Meter wide internal road, South Godown No 70   | Rs 5,23,814.50/-<br>As per demand notice<br>dated 27.02.2018<br>& subsequent interest<br>as per agreement | NIL<br>symbolic<br>possession  | 6,21,000   | (i) 62,100<br>(ii) Rs. 10,000.00   | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 13.       | Pravin Kumar Dwivedi (Applicant) Priyanka Dwivedi (Co Applicant) 5, Shivam residency, Behind Jai Ambe Party plot, Unjha, District Mehsana - 384170 Union Bank of India (Unjha)  | All the pieces and parcel of immovable property bearing Revenue Survey No. 961 T.P. No. 5, F. Plot No 103 paiki, Block No. "H" paiki, 1st floor, Flat No. H-103 with construction admeasuring in aggregate about 149.00 sq. Mtrs super Built Up area at "NOBLE HEIGHT" 80.00 Feet Ring Road, Unjha Ta. Unjha DistMehsana, belongs to Mrs. Priyanka Dwivedi, <b>Boundaries</b> :-East:- Open space with tarace, West:- Passage, North;-Wall of said flat, South;-Flat No. 104                                 | Rs. 7,53,325.17<br>As per demand notice<br>dated 12.01.2022<br>& subsequent interest<br>as per agreement  | NIL<br>Physical<br>possession  | 27,14,000.00   | (i) 2,71,400.00<br>(ii) 10,000.00  | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |
| 14.       | Saiyad Rahim Fajalaali Valnde Saidumiya (Applicant) Saiyad Noorjaha (Co applicant) Saiyad Sabbirali Fazalali (Guarantor) 2/14/38 Navovas, Fateh Darwaza Andar, Visnagar District Mehsana - 384315 Union Bank of India (Visnagar-2)  | All the pieces and parcel of immovable property belongs to Mr. Salyad Rahim Fajalaali Valnde Saidumiya, Situated at Tika No.3/2, in Revenue Survey No.107, Admeasuring to 126.42.28 Sq.Mtrs, Navovas (Oradi), Village –Visnagar (Rural), Mouje and Taluka-Visnagar, District Mahesana, Gujarat State. And bounded by. <b>Boundaries</b> :- East:-Road, West:- Survey No.104,105,106, North:-Survey No.101, South:-Road   | Rs. 22,35,512.69 As per demand notice dated 01.09.2022 & subsequent interest as per agreement             | NIL<br>symbolic<br>possession  | 49,70,000.00   | (i) 4,97,000.00<br>(ii) Rs. 10,000.00                                      | Mr. Yegdutt Shukla<br>(Chief Manager)<br>MB 8850652663        |


For participating in the e-auction sale, the intending bidders should register their details with the service provider https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp well in advance and shall get the user id and password. Intending bidders are advised to change only the password immediately upon receiving it from the service provider. Bidder may visit https://www.ibapi.in where guidelines for bidders are available with educational videos. Bidders have to complete following formalities well in advance. Step 1 Bidder Registration on e auction platform using his mobile no. and email-id. Step 2 KYC verification: Bidder to upload requisite KYC documents. It shall be verified by e auction provider (may take 2 working days). Step 3 Tranfer of EMD amount to Bidder Global EMD wallet: Online/offline transfer of fund using NEFT/transfer using challan generated on e auction platform. Step4 Bidding process and auction result: Interested registered bidders can bid online on e auction platform after completing Step 1,2 &3. For detailed terms and conditions of sale, please refer to the link provided bank's website www.unionbankofindia.co.in

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) /RULE 9(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002

This may also be treated as notice under rule 8(6) /rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to the borrower/s and guarantor/s of the said loan about the holding of E-Auction Sale on the above mentioned date.

Ahmedabad

Authorized Officer, Union Bank of India



Place: Ahmedabad / Gandhinagar